



KALPA-TARU®

KALPATARU POWER TRANSMISSION LIMITED

Factory & Registered Office :
Plot No. 101, Part-III, G.I.D.C. Estate, Sector-28,
Gandhinagar-382 028, Gujarat. India.
Tel. : +91 79 232 14000
Fax : +91 79 232 11951/52/66/71
E-mail : mktg@kalpatarupower.com
CIN : L40100GJ1981PLC004281

KPTL/22-23
September 27, 2022

BSE Limited Corporate Relationship Department Phiroze Jeejeebhoy Towers Dalal Street, Fort MUMBAI - 400 001. <u>Script Code: 522287</u>	National Stock Exchange of India Ltd. 'Exchange Plaza', C-1, Block 'G', Bandra-Kurla Complex Bandra (E) MUMBAI – 400 051. <u>Script Code: KALPATPOWR</u>
--	---

Sub.: Newspaper Advertisement of Kalpataru Power Transmission Limited pursuant to the directions of the Hon'ble National Company Law Tribunal, Ahmedabad Bench

Respected Sir(s),

Pursuant to the provisions of Regulation 30 read with Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and in accordance with the directions given by the Hon'ble National Company Law Tribunal, Ahmedabad Bench *vide* its Order dated 20th September, 2022, we enclose herewith the copies of newspaper advertisements published today i.e. on Tuesday, 27th September, 2022 in 'Financial Express' in English Language having nationwide circulation and 'Sandesh' in Gujarati Language, having wide circulation in the State of Gujarat, for advertisement of Notice of hearing *inter alia*, calling for objections, if any, on or before the date of hearing scheduled on 19th October, 2022.

The aforesaid Notice is also uploaded on the website of the Company: www.kalpatarupower.com.

Kindly take the same on record.

Thanking you,

For **Kalpataru Power Transmission Limited**

Krunal Shah
Compliance Officer

Encl.: a/a

ISO 9001 CERTIFIED COMPANY

Corporate Office : 81, Kalpataru Synergy, Opp. Grand Hyatt, Santacruz (E), Mumbai-400 055. India.
Tel. : +91 22 3064 2100 ■ Fax : +91 22 3064 2500 ■ www.kalpatarupower.com

Motherhood to acquire Ichikoh's mirror biz

PRESS TRUST OF INDIA
New Delhi, September 26

AUTO COMPONENTS MAKER Samvardhana Motherson Automotive Systems Group on Monday said it will fully acquire the mirror business of Japan's Ichikoh Industries for an enterprise value of 5.2 billion yen (nearly ₹300 crore). The group, through its Vision Systems division, has entered into an agreement with Ichikoh, a subsidiary of Valeo, in Japan to buy 100% of the latter's mirror business, Samvardhana Motherson Automotive Systems Group said in a statement. The transaction is subject to customary closing adjustments for debt/debt-like items

and working capital, it added. This will be the group's first acquisition in Japan. The deal includes Ichikoh's mirror business — development and manufacturing of automotive mirrors and associated products — in Japan and China, catering largely to Japanese original equipment manufacturers, the group said, adding the target business reported revenues of 15.8 billion yen in 2021. "With this transaction, Motherhood will add three manufacturing facilities across Japan and China and 260 patents to its IP portfolio," it added. According to Motherhood group chairman Vivek Chaand Sehgal, "inorganic growth is an integral part of our Vision 2025."

STRONG RESPONSE TO BRAHMASTRA PVR banks on high festive footfall

GEETA NAIR
Pune, September 26

WITH BRAHMASTRA ENTERING the fifth week and continuing to report strong box office collections during the September 24-25 weekend, has raised expectations of a good festive season for film exhibitor PVR Cinemas.



PVR opened a new six-screen property in Pune on Monday

Chandresh Daftary, regional director, west, PVR Cinemas, said PVR's admissions have reached nearly 95% of pre-pandemic levels. Besides *Brahmastra* pulling crowds, especially teen viewers, regional films have also drawn audiences, with Marathi, Gujarati and Bengali films doing well, Daftary said.

After a series of duds (*Lal Singh Chaddha*, *Samshera*, *Samar Prithviraj*, *Raksha Bandhan*), the company is now banking on the festival rush to cinema halls to revive fortunes.

The line-up starts with Saif Ali Khan, Hrithik Roshan and Radhika Apte-starrer *Veeram Vedha*, a remake of a Tamil film, which is set for release on September 30. The company is enthused with the advance bookings that are coming on Monday.

Other films it is banking on are Mani Ratnam's *Ponniyin Selvan* in five languages, *Goodbye, Godfather* (in four languages),

₹350 cr investment planned for 100 new screens in FY23

PVR Cinemas will invest up to ₹350 crore to open 100 new screens in FY23, a top official said on Monday. It also expects its mega-merger with Inox Leisure to

close by February 2023, after which it will start to run as a combined business, PVR's chief executive Gautam Dutta said. — PTI

Thank God and Doctor G during the Dussehra-Diwali period, followed by *Avataar-II* during the Christmas week, Rohit Shetty's Ranveer Singh-starrer *Circus* slated for a New Year release, and Shah Rukh Khan's *Pathan*.

Daftary said if the content is good, people are willing to spend money, so one cannot write the medium off. The company also screened the recent India-Pakistan cricket match across 120 screens and saw close to 90% occupancy, he said.

The brick-and-mortar model is here to stay and PVR will continue with its expansion plans, he said. Daftary said PVR Cinemas is on track to add 115-120 screens this year, with 20 screens already done and 90-odd screens slated to be completed in second half of FY23.

On Monday, PVR opened a new six-screen property in Pune to take its total tally in the country to 864 screens, 175 cinemas and 76 cities.

The new PVR comes with the 403-seater Premium Extra Large (PXL) format. The Pune P [XL] gets first-of-its-kind 4K laser projection apart from Dolby Atmos sound, Real-D 3D and a screen size of 67.88 x 37.23 ft.

SC junks Sebi petition in Bajaj Auto scrip case

INDU BHAN
New Delhi, September 26

THE SUPREME COURT on Monday rejected the Sebi's appeal seeking to penalise a former stock broker in the case of circulation of unpublished price sensitive information (UPSI) through WhatsApp messages in the scrip of Bajaj Auto.



THE CASE

A Bench led by Chief Justice UU Lalit dismissed the Sebi's appeal against the Securities Appellate Tribunal's (SAT) order in March last year that had set aside the penalty of ₹15 lakh imposed on Shruti Vora for allegedly forwarding UPSI of six companies on WhatsApp.

It also observed that the two individuals — Neeraj Kumar Agarwal and Shruti Vora — then employees of Antique Stock Broking, had forwarded the messages and the SAT had quashed the penalty of ₹15 lakh imposed on them for circulating UPSI related to quarterly results of Bajaj Auto through WhatsApp prior to official announcement by the company.

"They are secondary chain. They have just forwarded the messages. It would mean upsetting everything and putting the burden again on them, which we are not willing to do... On the facts and circumstances of the case, we find no reason to entertain the appeal," the CJ said, adding that the investigative machinery was not able to find the source of information.

UPSI refers to any information related to a company or its securities that is not generally available and is likely to materially affect the price of the securities.

Senior counsel CU Singh, appearing for Sebi, argued that the identified messages "accurately" matched the financial results finally published by the companies and as per the PIT norms, any person who is in possession of UPSI is regarded as an insider. He said that Vora

being insider (stock broker) had communicated the UPSI related to Bajaj Auto as she was also advising insurance companies. This is in violation of PIT (Prohibition of Insider Trading) Regulations, he contended.

Sebi had initiated a preliminary examination on circulation of UPSI through WhatsApp groups, during which search and seizure operations for 26 entities were conducted and approximately 190 devices, records etc, were seized. The investigation revealed that Kumar and Vora communicated the UPSI related to Bajaj Auto — total income, EBITDA and PAT for the quarter ended March 2017 a few days before the results were due. Bajaj Auto was one of the firms whose quarterly financial results for the fourth quarter of 2016-17 closely matched the messages circulated in the WhatsApp chats.

SAT, while ruling in favour of the two individuals, had observed that the source of these messages could not be established by Sebi and it could not find leakage of information. It had accepted the stand of Vora and Agarwal that the messages had originated from brokerage houses or some platforms and were already available in the public domain.

The tribunal had held that 'information constituted UPSI only when the person getting such information was aware that such information was unpublished, and price sensitive in nature' and that such knowledge can be established on the basis of preponderance of probabilities on attendant circumstances.

The PIL seeks relief, including a direction to recognise rights of women other than married women above 35 to avail surrogacy

The ban on commercial surrogacy, seemingly enacted to protect the impoverished women, denudes surrogates of their right over their bodies and denies them the opportunity to exercise agency over their right of giving birth," the petition said.

A bench led by Justice Ajay Rastogi sought response from the ministries of health and family welfare, women and child development and the Indian Council for Medical Research on a petition by Chennai-based an IVF specialist Arun Muthuvel seeking various reliefs, including a direction to recognise rights of women other than married women above 35 years of age to avail surrogacy as a means of assisted reproductive technique to experience motherhood. Counsel Mohini Priya, appearing for Muthuvel, said an unreasonable blanket ban on commercial surrogacy while allowing only altruistic surrogacy may lead to further exploitation of women within the family.

U.P. CO-OPERATIVE SUGAR FACTORIES FEDERATION LTD.
9-A, Rana Pratap Marg, Lucknow
Tel No. - (0522) 2204183, (0522) 2612949 PBX, (0522) - 2201856, 2615722, 2612849
Fax: (0522) 2627994, वेबसाइट: www.upsugarfed.org ईमेल: upsugarfed@yahoo.co.in
Ref. No. : UPSUGARFED/07/GM/AT/Prj Fin/35A Dt. 26.09.2022

ई-टेंडर नोटिस

उपरोक्त को सहकारी क्षेत्र में निम्न कामगारों आसानी का विचारित वर्ष 2022-23 एवं 2023-24 के दौरान तकनीकी संशोधन तथा सम्पन्न एवं एक एकाद, आउटसोर्सिंग के माध्यम से करवाये हेतु पार्टी का बजट करने के लिए अग्रणी निविदादाताओं से ई-निविदा आमंत्रित की जाती है। ई-निविदा की विवरण निम्न व नीचे ई-टेंडर पोर्टल <https://tender.upnic.in> एवं सारा को वेबसाइट www.upsugarfed.org पर दिनांक 27.09.2022 से उपलब्ध रहेगी। तकनीकी व वित्तीय विवरण का कार्यालय निम्नलिखित है-

ई-निविदा तकनीकी विवरण का अंतिम तिथि व समय	ई-निविदा तकनीकी विवरण को लिखित व समय	ई-निविदा को वित्तीय विवरण को लिखित व समय
20.10.2022 6.55 PM	21.10.2022 11.00 AM	21.10.2022 3.00 PM

प्रत्येक निविदाक सारा को एक अग्र्य समस्त निविदाओं को फिना कार्गन त्वाये फिनाल करने का अधिकार सुरक्षित रहेगा। परीक्षा धनराशि (₹ एक ली.) - ₹. 10,000 लाख मात्र, ई- निविदा प्रपत्र शुल्क - ₹. 10,000/- + 18 प्र.श. जीएसटी. (नॉन रिफ़ंडेबल)

प्रबन्ध निदेशक

SABOO SODIUM CHLORO LIMITED
Registered & Corporate office: L5-B II Krishna Marg, C- Scheme Jaipur, Rajasthan - 302001 | Tel No: +91 141 2372946 / 2379483
E-Mail ID: salt@suryasalt.com | Website: www.suryasalt.com
CIN: L24117RJ1993PLC007830

FOR THE ATTENTION OF REGISTERED MEMBERS OF PARTLY PAID-UP EQUITY SHARES PAYMENT OF FIRST AND FINAL CALL

The Board of Directors at its Board Meeting held on Wednesday, September 14, 2022, decided the following:

- Fixed the record date as Thursday, September 22, 2022 for the purpose of determining the shareholders to whom the call notice will be sent for payment of First and Final Call on 1.78.95.050 partly paid-up equity share (Partly Paid-Up Equity Shares) issued and allotted by Saboo Sodium Chloro Limited (Company) on Tuesday, August 02, 2022, pursuant to rights issue offer vide letter of offer dated Tuesday, June 14, 2022.
- Further, in accordance with the disclosures included in the Letter of offer dated Tuesday, June 14, 2022, the Partly Paid-up Equity shares in respect of which the Call payable remains unpaid, shall be forfeited at any time after the last date of payment of call money due.

In continuance to the above, at the meeting held on Wednesday, September 14, 2022 of the Board of Directors with reference to the LDR, has decided the following:

- The Call Money for the purpose of making the balance money payment by the Partly Paid-up Equity Shareholders will commence on Monday, October 03, 2022 and ends on Monday, October 17, 2022.
- The Trading of Partly Paid-up Equity Shares of the Company (BSE Scrip Code: 890170ISIN: IN9440C01014 suspended with effect from September 23, 2022.
- Further Separate email intimation sent to all the Partly-paid Equity shareholders of the Company alongwith the detailed Call Money Notice and payment methods has been dispatched by e-mail on Monday, September 26, 2022 to all the holders of the partly paid-up equity shares of the Company as on the record date i.e. Thursday, September 22, 2022.

For Saboo Sodium Chloro Limited
On behalf of the Board of Directors
Sd/-
Girdhar Gopal Saboo
Managing Director
Place: Jaipur
Date: 26.09.2022

BEFORE THE NATIONAL COMPANY LAW TRIBUNAL CHANDIGARH BENCH, AT CHANDIGARH COMPANY PETITION CP (CAA) NO. 55/CHD/HRY/2022 CONNECTED WITH COMPANY APPLICATION CA (CAA) NO. 10/CHD/HRY/2022 (under Sections 230-232 of the Companies Act, 2013) IN THE MATTER OF THE COMPANIES ACT, 2013 AND IN THE MATTER OF THE COMPOSITE SCHEME OF ARRANGEMENT BETWEEN NETTLE INFRASTRUCTURE INVESTMENTS LIMITED AND TELESONIC NETWORKS LIMITED AND THEIR RESPECTIVE SHAREHOLDERS AND BHARTI AIRTEL LIMITED

AND

IN THE MATTER OF: Nettle Infrastructure Investments Limited, a company incorporated under the Companies Act, 1956, having its registered office at Airtel Center, Plot No. 16, Udyog Vihar, Phase-IV, Gurugram, Haryana - 122015. ...Transferor Company 1 / Petitioner Company 1

AND

Telesonic Networks Limited, a company incorporated under the Companies Act, 1956, having its registered office at Airtel Center, Plot No. 16, Udyog Vihar, Phase-IV, Gurugram, Haryana - 122015. ...Transferor Company 2 / Petitioner Company 2

AND

Bharti Airtel Limited, a company incorporated under the Companies Act, 1956, having its registered office at Airtel Center, Plot No. 16, Udyog Vihar, Phase-IV, Gurugram, Haryana - 122015. ...Transferee Company / Petitioner Company 3

NOTICE OF PETITION

A joint second motion petition ("Petition") under Sections 230 to 232 and other applicable provisions of the Companies Act, 2013 for obtaining the sanction to the composite scheme of arrangement between Nettle Infrastructure Investments Limited and Telesonic Networks Limited and their respective shareholders and Bharti Airtel Limited (together, the "Petitioner Companies") was presented by the Petitioner Companies on the 31st day of July, 2022, and the said Petition is fixed for hearing before the Chandigarh Bench of the National Company Law Tribunal at Chandigarh on the 14th day of October, 2022.

Any person desirous of supporting or opposing the said Petition should send to the Petitioner Companies or their advocates, notice of his/her intention, signed by him/her or his/her advocate, with his/her name and address, so as to reach the Petitioner Companies or their advocates not later than two days before the date fixed for the hearing of the Petition. Where he/she seeks to oppose the Petition, the grounds of opposition or a copy of his/her affidavit shall be furnished with such notice. A copy of the Petition will be furnished by the undersigned to any person requiring the same on payment of the prescribed charges for the same.

Dated this 26th day of September, 2022.

Sd/- Sd/-
Atul V. Sood, Advocate Bharat Apte, Advocate
Mobile: +91 9815992288 Mobile: +91 9999030207
Email: atulsood@gmail.com Email: bharat.apte@abzpartners.com
#3273, Sector 15-D, Chandigarh AZB & Partners, Advocates & Solicitors
Advocate for the Petitioner Companies Plot No. 8, Sector - 4, Noida, U.P. 201301
Advocate for the Petitioner Companies

For Bharti Airtel Limited
For Telesonic Networks Limited
Sd/-
Rohit Krishan Puri
(Authorized Signatory)

BEFORE THE HON'BLE NATIONAL COMPANY LAW TRIBUNAL AT AHMEDABAD CP (CAA) NO. 63 OF 2022 IN CA (CAA) NO. 43 OF 2022

JMC Projects (India) Limited ...Petitioner Company No.1/
Transferor Company
Kalpataru Power Transmission Limited ...Petitioner Company No.2/
Transferee Company

NOTICE AND ADVERTISEMENT OF NOTICE OF HEARING ON THE PETITION

Notice is hereby given that by an order dated 20.9.2022, the Hon'ble National Company Law Tribunal, Ahmedabad Bench has admitted CP (CAA) No. 63/NCLT/AHM/2022 seeking sanction to the Scheme of Amalgamation of JMC Projects (India) Limited with Kalpataru Power Transmission Limited and their respective shareholders and the petition is fixed for hearing on 19.10.2022.

In pursuance of the said order and as directed therein notice is hereby given calling for objections, if any, on or before the date of hearing. Copies of the Scheme of Amalgamation can be obtained free of charge at the registered office of the respective companies or at the office of its Advocates viz. Thakkar and Pahwa, Advocates at 71, New Tower-A, Thaltej Cross Roads, S.G. Highway, Ahmedabad-380054.

Dated this 26th day of September, 2022.

M/s. Thakkar and Pahwa
Sd/-
Advocates for the Petitioner Companies

TCI FINANCE LTD.
Regd. Office: Plot no-20, Survey no-12, 4th Floor, Kothaguda, Kondapur, Hyderabad-500084, Telangana.
CIN: L65910TG1973PLC031293, Phone no: 040-71204284, FAX No: 040-23112318, Website: www.tcofin.in, Email: investors@tcofin.in

Information Regarding 48th Annual General Meeting to be held through Video Conferencing (VC)/Other Audio Visual Means (OAVM)

Notice is hereby given that the 48th Annual General Meeting ("AGM") of the members of TCI Finance Limited (the Company) will be held on Thursday, October 20, 2022, at 11:00 a.m., through Video Conferencing ("VC") Other Audio Visual Means ("OAVM") in compliance with all the applicable provisions of the Companies Act, 2013 and the Rules made thereunder and the securities and Exchange Board of India ("SEBI") (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, read with General Circular No. 14/2020 dated April 08, 2020, General Circular No. 17/2020 dated April 13, 2020, General Circular No. 20/2020 dated May 5, 2020, and General Circular dated January 13, 2021, December 08, 2021, December 14, 2021 and May 05, 2022 and other applicable circulars issued by the Ministry of Corporate Affairs ("MCA") and SEBI Circular dated May 12, 2020, January 15, 2021 and May 13, 2022 (collectively referred to as "relevant circulars"), to transact the business that is set out in the Notice of the AGM. Members will be able to attend the AGM through VC/OAVM. Members attending the AGM through VC/OAVM shall be reckoned for the purpose of quorum under Section 103 of the Act.

In compliance with the relevant circulars, the notice of the AGM and the standalone financial statements for the financial year 2021-22, along with Board's Report, Auditors' Report and other documents required to be attached thereto (i.e. Annual Report 2021-22) will be sent to all the Members through electronic mode whose email IDs are registered with the Registrar & Transfer Agent (RTA) of the Company or Depositories. The aforesaid documents are also on the website of the Company at www.tcofin.in, website of NSDL, our e-voting facility provider, at www.evoting.nsdl.com and websites of the stock exchanges i.e. National Stock Exchange of India Limited at www.nseindia.com and BSE Limited at www.bseindia.com.

Manner of registering/ updating email addresses is below:
If your email ID is already registered with the Company/RTA/Depositories, login details for e-voting are being sent on your registered email id. The same login credentials may also be used for attending the AGM through VC/OAVM. Shareholders who have still not registered their e-mail ID are requested to get their e-mail ID registered, as follows:

- Shareholders holding Shares in Physical Mode:** Shareholders holding shares in physical mode and who have not updated their email address are requested to update their email address by writing to the Registrar and Share Transfer Agent of the Company, viz., Kfin Technologies Private Limited ("KfinTech") at einward.ris@kfintech.com, along with the copy of the signed request letter mentioning the name and address of the Shareholder, scanned copy of the Share Certificate (front and back), self-attested copy of the PAN Card, and self-attested copy of any document (eg., Driving License, Election Identity Card, Passport) in support of the address of the Shareholder.
- Shareholders holding Shares in Dematerialized Mode:** Shareholders are requested to register/update their e-mail ID with the relevant Depository Participant(s) with whom they maintain their demat accounts.
- After due verification, the NSDL will forward you e-voting login credentials to your registered email address.

Any person who becomes a member of the company after dispatch of the Notice of the AGM and holding shares as on the cut-off date may obtain the User ID and password in the manner as providing to the Registrar and Share Transfer Agent on company's website and NSDL's website.

Such members may cast their votes using the e-voting instructions, in the manner specified by the Company in the Notice of AGM.

Manner of casting vote(s) through e-voting:

- Members will have an opportunity to cast their vote(s) on the business as set out in the Notice of the AGM through electronic voting system ("e-voting").
- The manner of voting remotely ("remote e-voting") by members holding shares in dematerialized mode, physical mode and for members who have not registered their email addresses has been provided in the Notice of the AGM.
- The facility for voting through electronic voting system will also be made available at the AGM and Members attending the AGM who have not cast their vote(s) by remote e-voting will be able to vote at the AGM.
- The login credentials for casting votes through e-voting shall be made available to the members through e-mail. Members who do not receive e-mail or whose e-mail addresses are not registered with the Company/RTA/ Depository Participant(s), may generate login credentials by following instructions given in the notes to the Notice of the AGM.
- The same login credentials may also be used for attending the AGM through VC/OAVM.

For TCI Finance Limited
Sd/-
Deeksha Verma
Company Secretary
M.No.A59524
Place : Hyderabad
Date : 26-09-2022

U.P. CO-OPERATIVE SUGAR FACTORIES FEDERATION LTD.
9-A, Rana Pratap Marg, Lucknow. Tel No. (0522) 2612949, (0522) 2628310, Fax: (0522) 2627994, Website: www.upsugarfed.org

Short term e-tender Notice

Online e-bids are invited for the sale of different kind of Alcohol (SDS, ENA) from Cooperative Distilleries of U.P. to reputed Distilleries of India, bonafide registered users to whom license has been issued by the Excise Department and approved traders holding valid license of Excise department of the concerned State. E-bid can be uploaded upto 06.55 P.M. on 10.10.2022. Technical bid will be opened at 11.30 AM on 11.10.2022 and Financial bid at 3.30 PM on 12.10.2022. E-bid minimum EMD is Rs. 100000/- EMD is variable if quoted quantity is above 01.00 lac BL. The rate at which EMD shall increase will be Rs 1.00 per BL. Total quantity for sale of Alcohol is approximately 22.20 lac BL and Tender cost Rs. 2000/- + 18% GST (Non refundable). The details for submission of e-bids will be available on the e-tender PORTAL <http://tender.upnic.in> and also on Federation website www.upsugarfed.org since 23.09.2022 at 06.55 P.M. The Managing Director Federation reserves the right to cancel any or all the e-bids without assigning any reason. The decision of the Managing Director shall be final and binding.

दिनांक 29.09.2022, 19.07.2022, 29.07.2022 एवं 06.09.2022 को आमंत्रित ई-निविदा जो को निरस्त हो गयी थी मे क्रेता पाठियों द्वारा जमा परीक्षा धनराशि इस आकस्म में माफ्य रहेगी।
UPSUGARFED (IGM/AT) /25/3C
Date: 23.09.2022 MANAGING DIRECTOR

GUJARAT ENERGY TRANSMISSION CORPORATION LTD.
Regd. Office: Sardar Patel Vidyut Bhavan, Race Course, Vadodra (Gujarat) : 390007

e-TENDER NOTICE INVITING TENDERS OF GETCO CORPORATE OFFICE, VADODARA
GETCO: www.getcojaguar.com Dept: https://www.nprocure.com

Tender Notice No. CE (P&C): TN - 11 - 22-23

[A] Procurement: For Purchase of (1) Steel Material, (2) 220kV & 132kV C&R (3) GI Earthing (4) Battery Sets and Charger (5) 66kV to 220 kV Tower Materials (6) 66kV CRP.

[B] Civil: 1. CE(P & C)/Contracts/Civil-77,78,79,80,81,84,85,86,87,89,90,91,93,95,96,98,99,100/22-23/66kV Mankani, Bedkuvadar s/s, Untdi-Bigri (Dholai Salabet), Kathodara, Daheli s/s under Navsari Circle, Umelac & Tadkeshwar s/s, Umalla, Untdi-Bigri (Dholai Salabet), Pardi-Idris, & Panoli, Kheda, Gunja, Kathodara, Kathalal, Bharudi, Mahudha, Delvada & Otapur, Ghanteshwar, Daheli, Singa (Eklara), Karmasad & Nadiad, Pachchham S/S.

Construction of Control Room Building, Foundations & Misc civil works etc at 66kV Mankani s/s under Jambuva Circle, Bedkuvadar s/s, Untdi-Bigri (Dholai Salabet), Kathodara, Daheli s/s under Navsari Circle, Umelac & Tadkeshwar s/s, Umalla, Untdi-Bigri (Dholai Salabet), Pardi-Idris, & Panoli, Kheda, Singa (Eklara) s/s under Himmatnagar Circle, Gunja, Delvada & Otapur s/s under Mehsana Circle, Kathalal, Mahudha, Karmasad & Nadiad, s/s under Nadiad Circle, Bharudi, Ghanteshwar s/s under Gondal Circle, Pachchham s/s under Surendranagar Circle.

Above Tender is available on web-site www.getcojaguar.com (for view and download only) & <https://nprocure.com> (for view, download and on line tender submission).

Note: Bidders are requested to be in touch with our website till opening of the Tender.
"Energy Saved is Energy Generated"
No.CE(P&C)/TN-11/2022-23/2037 Date:26.09.2022
Chief Engineer
(Procurement & Contracts)

DELHI JAL BOARD: GOVERNMENT OF NCT OF DELHI OFFICE OF THE CHIEF ENGINEER (SDW) C/O EXECUTIVE ENGINEER (SDW)-III STP YAMUNAVIHAR, WAZIRABAD ROAD DELHI-110053
Tele-22814128, Email: eesdw3.djb@nic.in

Subject:- Press Tender Notice- NIT No. 12 (2022-23)

S. No.	Description of work	Date of Uploading on E-Procurement solution/ Tender ID/ Pre-bid meeting	Estimated cost/Earnest Money & Tender Fee	Last date of submission of tender
1	Augmentation/ Up-gradation of various existing STPs at Yamuna Vihar Ph-I (10MGD) & III (25MGD), Delhi (Package-4) (Re-invited)	23.09.2022 / 2022_DJB_229906_1 / 04.10.2022	20 Lakh deposit + 1.96 Cr in the form of BG/ 1500-	20.10.2022 at 03:00 PM

For further details in this regard can be seen at <https://govtprocurement.delhi.gov.in>

ISSUED BY P.R.O. (WATER) (Bhushan Verma)
Adv. No. J.S.V. 353/2022-23 Exe. Engineer (SDW)-III

"STOP CORONA: WEAR MASK, FOLLOW PHYSICAL DISTANCING, MAINTAINING HAND HYGIENE"

Markfed
A House Of Quality Food Products

The Punjab State Cooperative Supply & Marketing Federation Ltd. "Markfed House" Plot-4, Sector-35-B, Chandigarh

The Punjab State Cooperative Supply & Marketing Federation Limited invites online tenders for the purchase of the following items during the period 27.09.2022 to 31.12.2022 for supply at Markfed Cattlefeed and Allied Industries, Kapurthala and Gilderbaha.

Sl. No.	Item	Quantity	Unit
1.	Rice Bran Extraction		
2.	Rice Bran		
3.	Mustard Extraction		
4.	Mustard Cake		
5.	Rice Nakkku		
6.	Soyabean Extractions		
7.	Gowar Korma		
8.	Cottonseed Cake		
9.	Groundnut Cake (Oiled)		
10.	Maize		
11.	Wheat Bran		

The tenders shall be opened on every Friday during 27.09.2022 to 31.12.2022 as per following details:-

Group	Item	Date of opening of tender
Group 'A'	Rice Bran Extraction, Rice Bran, Maize and Mustard Extraction	Date for Sep, 2022 (30.09.2022) Date for Oct, 2022 (07.10, 21 and 28.10.2022) Date for Nov, 2022 (04.11.18 and 25.11.2022) Dates for Dec, 2022 (02.09, 16, 23 and 30.12.2022)
	Mustard Cake, Rice Nakkku, Cottonseed cake, Groundnut Cake (Oiled), Wheat Bran and Gowar Korma	Dates for Oct, 2022 (07 and 21.10.2022) Dates for Nov, 2022 (04 and 18.11.2022) Dates for Dec, 2022 (02 and 16.12.2022)
Group 'B'	Soyabean Extraction	Dates for Oct, 2022 (21.10.2022) Dates for Nov, 2022 (18.11.2022) Dates for Dec, 2022 (16.12.2022)

The tender can be submitted upto Thursday 3.30 PM and will be opened at 11.00 AM on next day each designated days in presence of supplier/s or their representative who wish to be present. The quantity to be procured in each tender will be mentioned on the e-tender document to be uploaded on every Tuesday on the site eproc.punjab.gov.in. The tender form fee and earnest money shall have to be deposited by online mode only.

Managing Director
Markfed

Plea should be heard on merit now, says Valli

SAJAN C KUMAR
Chennai, September 26

FOLLOWING THE NCLAT'S recent dismissal of appeals by Murugappa holding company Ambadi Investments (AI) against her application to the tribunal, Valli Arunachalam now hopes her fresh waiver application before the NCLT Chennai bench is heard on merit.

In an interaction with FE, Arunachalam said, "Now the waiver application has to be argued in NCLT and while all the technicalities have been laid to rest with the quashing of all appeals against my case by NCLAT, we hope that we will finally get to argue the matter on the merit. Of course, we will have to pass through the waiver application, I hope we will, and the company petition needs to be argued, where the core of the matter lies, which is gender discrimination, oppression and mismanagement."

